

Knowledge Consortium of Gujarat

General Written Test for Recruitment of Various Posts

Revised Examination Schedule-2017

Date	Time	Post
03/08/2017 Thursday	10:30 To 01:30	Head of Initiative
03/08/2017 Thursday	02:30 To 05:30	Program Officer
04/08/2017 Friday	10:30 To 01:30	Project Executive
04/08/2017 Friday	02:30 To 05:30	IT Manager
04/08/2017 Friday	02:30 To 05:30	Legal Officer

N.B. Place of Examination: Gujarat Arts and Commerce College, Ellisbridge, Ahmedabad

નોંધ: વરસાદ તથા વાંચવાના સમયને ધ્યાનમાં રાખી પરીક્ષાની તારીખો લંબાવવામાં આવી છે.

લેખિત પરીક્ષા અંગે સૂચનાઓ:

૧. દરેક પોસ્ટની લેખિત પરીક્ષા ૦૩ કલાક અને ૧૦૦ ગુણની રહેશે.
૨. પ્રશ્નપત્રમાં આપેલ સૂચનાઓ અનુસાર જવાબ આપવાના રહેશે.
૩. સ્નાતક/અનુસ્નાતક કક્ષા તથા અનુભવના જાહેર કરેલ પદ્ધતિ પ્રમાણે પ્રાપ્ત કરેલ ગુણના ટોટલના આધારે જે મેરીટ લીસ્ટ તૈયાર થયેલ છે, તેમાંથી મેરીટના ક્રમાનુસાર રિક્રુટમેન્ટમાં જાહેર કરેલ જગ્યાઓ અંગેના નિયમો અનુસાર જે તે જગ્યાના છ ગણા ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે. જેમને મેરીટ લીસ્ટ અંગે કઈ રજુઆત કરવાની હોઈ તો જાહેર થયાના બે દિવસમાં રજુઆત કરવી, ત્યારબાદ જાહેર થયેલ મેરીટ લીસ્ટ ફાઈનલ ગણાશે.
૪. જે અરજદારોએ ગુણ પત્રક મુક્યા નથી, અથવા જેમના ગુણ/ટકાવારી સ્પષ્ટ થતા નથી, તેમની અરજીઓ આપોઆપ નિયમો અનુસાર રદ થયેલ ગણાશે.

૫. પરીક્ષામાં હાજરી આપતી વખતે આપે આધારકાર્ડ/ઈલેક્શન કાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ પૈકીનો ઓછામાં ઓછું કોઈપણ એક ઓળખપત્ર લાવવાનું રહેશે, અને વર્ગ નિરિક્ષક અથવા અધિકારી માંગે ત્યારે બતાવવાનું રહેશે.બને ત્યાં સુધી આધારકાર્ડ જ રાખવું.

૬. પરીક્ષાનું સ્થળ ગુજરાત આર્ટસ અને કોમર્સ કોલેજ, એલિસબ્રિજ અમદાવાદ રહેશે. તે અંગેની માહિતી વેબસાઈટ પર જાહેર થશે.

૭. જવાબવહી ઉપર તથા/અંદરના પાન પર જે સૂચનાઓ આપેલી હોય તેનો ચુસ્ત અમલ કરવો.

૮. બધી પરીક્ષાના જવાબો લેખિત સ્વરૂપમાં આપવાના છે, ઓબ્જેક્ટીવ પ્રશ્નો નથી.

૯. પરીક્ષાર્થીઓની યાદી વેબસાઈટ પર મુકવામાં આવશે, તેમાં બેઠક નંબર પણ આપવામાં આવશે.

૧૦. ઉમેદવારને પરીક્ષાખંડમાં પ્રવેશપત્ર અને ઓળખના પૂરાવા સિવાય પ્રવેશ મળશે નહીં, તથા કોઈ પણ ચીજ સાથે રાખી શકશે નહીં. ઉમેદવારે કોઈપણ પુસ્તક, હેન્ડ બેગ, કાગળ, સાહિત્ય તથા મોબાઈલ (સ્વિચ્ઠ ઓફ કે સાઈલેન્ટ મોડ કરેલો હશે તો પણ), કેલ્ક્યુલેટર જેવા કોઈ પણ વિજાણુ સાધનો રાખવા નહીં. આવી વસ્તુ(ઓ) આપની પાસેથી મળી આવશે તો, આપ આ પરીક્ષા અને સરકારની અન્ય પરીક્ષાઓ માટે પણ ગેરલાયક ઠરશો. ઉપરાંત આવી વસ્તુ(ઓ) જપ્ત કરવામાં આવશે અને શિસ્તભંગના ફોજદારી પગલાને પાત્ર ઠરશો.

૧૧. લેખિત પરીક્ષામાં જેના ૬૦% ગુણ આવશે માત્ર તેમને જ સમૂહ ચર્ચા, ઈન્ટરવ્યુ વગેરેમાં બોલાવવામાં આવશે. ૬૦% ગુણ ના લાવનારની ઉમેદવારી આપોઆપ રદ થશે.

૧૨. પરીક્ષાકેન્દ્ર પર એક કલાક પહેલા પહોંચી જવું, આવશ્યક છે.

૧૩. દરેક ઉમેદવારોને જવાબો લખવા ઉત્તરવહી આપવામાં આવશે, તેમાં બેઠક નંબર અવશ્ય લખવો. પ્રથમ પાન પર તમામ વિગતો ભરવી. સપ્લીમેન્ટરી તથા મુખ્ય જવાબવહી પર ખંડ નિરિક્ષકની સહી અચૂક લેવાની છે.

૧૪. ઈન્ટરનલ ઓપ્શન સાથે ૧૦ પ્રશ્નો રાખેલ છે. દરેકના ૧૦ ગુણ છે, તેથી દરેક પ્રશ્ન ૧૮ મિનીટ માટેનો રહેશે.

૧૫. ઉમેદવાર નકલ કરતાં ગેરરીતિ/ગેરશિસ્ત આચરતા જણાશે તો, ઉમેદવારને ગેરલાયક ઠેરવવા ઉપરાંત, ભવિષ્યની કેસીજી કે અન્ય સરકારી પરીક્ષામાં બેસવા માટે પ્રતિબંધ મુકવા ઉપરાંત ફોજદારી પગલાં સહિતની શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે. સીસીટીવી કેમેરા લાગેલા હોવાથી નકલ કરનાર અચૂક પકડાશે અને સજાને પાત્ર બનશે, તેની નોંધ લેશો.

૧૬. પરીક્ષા શરૂ થયા પછીથી પ્રવેશ મળી શકશે નહિ, તથા આ લેખિત અને વર્ણનાત્મક પરીક્ષા હોવાથી પ્રશ્નપત્ર લખવાનો સમય પૂરો ન થાય ત્યાં સુધી પરીક્ષાખંડ છોડી શકાશે નહીં.